

M.Com Semester - 2 (CBCS) Examination
March/April – 2024 (As Per Syllabus Year-2016)
CORPORATE FINANCIAL REPORTING (CORE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ રાજેશ લિ.ના પાકા સરવૈયા નીચે આપેલા છે. સમાનકદનાં નાંણાકીય પત્રકની ટેકનિકની મદદથી (૨૦)
 નાંણાકીય આર્થિક સ્થિતિ વિશે વિવેચન કરો.

જવાબદારીઓ	31-3-23 (રૂ.)	31-3-24 (રૂ.)	મિલકતો	31-3-23 (રૂ.)	31-3-24 (રૂ.)
ઈક્વિટી શેરમૂડી	1,00,000	2,00,000	કાયમી મિલકતો	80,000	2,00,000
પ્રેફરન્સ શેરમૂડી	20,000	40,000	રોકાણો	60,000	20,000
સામાન્ય અનામત	20,000	50,000	દેવાદારો	40,000	80,000
નફા-નુકસાન ખાતું	40,000	60,000	આખર સ્ટોક	20,000	80,000
લેણદારો	20,000	40,000	રોકડ	10,000	20,000
ચૂકવવાનાં બાકી ખર્ચા	10,000	10,000			
	2,10,000	4,00,000		2,10,000	4,00,000

અથવા

પ્રશ્ન-૧ નીચેની માહિતિ ઉપરથી તા. 31-03-2024 નાં રોજ મહેશ લિમિટેડનું પાકુ સરવૈયું તૈયાર કરો.

ચાલુ ગુણોત્તર	2.5
પ્રવાહી ગુણોત્તર	1.5
ચોખ્ખી કાર્યશીલ મૂડી	રૂ. 3,00,000
સ્ટોક ચલનદર(વેચેલ માલની પડતર/આખર માલ)	6 વખત
કાચા નફાનો ગુણોત્તર	20%
કાયમી મિલકતોનાં ઉથલાનો ગુણોત્તર (વેચેલ માલની પડતર)	2 વખત
સરેરાશ ઉઘરાણીની મુદત (દેવાદાર ગુણોત્તર)	2 મહિના
કાયમી મિલકતો સાથે શેરહોલ્ડર્સનાં ભંડોળનું પ્રમાણ	0.80
અનામત અને વધારા સાથે શેરમૂડીનું પ્રમાણ	0.50
લાંબાગાળાની લોન સાથે શેરહોલ્ડર્સનાં ભંડોળનું પ્રમાણ	0.20

પ્રશ્ન-૨ જય કંપનીનું તા. 31-03-2023 નાં રોજનું પાકુ સરવૈયું નીચે પ્રમાણે છે.

(૨૦)

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
ઈક્વિટી શેરમૂડી	10,00,000	કાયમી મિલકતો	12,00,000
અનામતો	4,00,000	સ્ટોક	2,00,000
ભરણવાળી લોન	4,00,000	દેવાદારો	4,00,000
લેણદારો	2,00,000	રોકડ-બેંક	2,00,000
	20,00,000		20,00,000

વર્ષ 2023-24 દરમિયાન કુલ ખરીદ-વેચાણ અને સંચાલન ખર્ચા અનુક્રમે રૂ. 10,00,000, રૂ. 16,00,000 અને રૂ. 2,00,000 હતા.

કાયમી મિલકતો પર 10% લેખે ધસારો ગણાય છે. તા. 31-03-2024 નાં રોજ સ્ટોક રૂ. 3,20,000, દેવાદારો રૂ. 5,00,000, લેણદારો રૂ. 2,40,000 અને રોકડ સિલક રૂ. 5,40,000 હતા.

સામાન્ય ભાવ સપાટીનાં આંક નીચે મુજબ હતા.

તા. 31-03-2023 નાં રોજ 400

તા. 31-03-2024 નાં રોજ 600

વર્ષ 2023-2024 સરેરાશ 480

ઉપરની માહિતિને આધારે ઐતિહાસિક પડતર પદ્ધતિ મુજબ તેમજ વર્તમાન ખરીદ શક્તિ(CPP) પદ્ધતિ મુજબ ભાવસપાટીમાં થયેલા ફેરફારની અસર આપી વાર્ષિક હિસાબો તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-૨ નીચેની માહિતિને આધારે વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ(CCA) હેઠળ ગિયરિંગ હવાલાની ગણતરી કરો.

વિગત	01-04-2023 (રૂ.)	31-03-2024 (રૂ.)
રૂપાંતરિત ડિબેચરો	20,00,000	24,00,000
બેંક ઓવરડ્રાફ્ટ	12,00,000	16,00,000
રોકડ	2,00,000	6,00,000
ભરપાઈ થયેલ શેરમુડી	30,00,000	40,00,000
અનામતો	10,00,000	16,00,000

(1) વેચાણ પડતરનો હવાલો(COSA) રૂ. 4,00,000

(2) નાંણાકીય કાર્યશીલ મૂડી હવાલો(MWCA) રૂ. 3,00,000

(3) ધસારો રૂ. 1,00,000

કુલ રૂ. 8,00,000

પ્રશ્ન-૩ ધી જ્યોતિ કં. લિ. નાં નીચેના આવક-ખર્ચ પત્રક પરથી મૂલ્ય વૃદ્ધિનું પત્રક તૈયાર કરો.

(૧૫)

તા. ૩૧મી માર્ચ ૨૦૨૪નાં રોજ પુરા થતા વર્ષનું આવક-ખર્ચ પત્રક

વિગત	રૂ.	રૂ.
વેચાણ	20,00,000	
બાદ: માલસામાનની પડતર	9,00,000	11,00,000
બાદ: (1) મજૂરી	4,00,000	
(2) ધસારો	1,00,000	
(3) વ્યાજ	2,00,000	7,00,000
		4,00,000
બાદ: કરવેરા		2,00,000
કરવેરા બાદનો નફો		2,00,000
બાદ: ડિવિડન્ડ		1,00,000
રાખી મૂકેલ કમાણી		1,00,000

અથવા

- પ્રશ્ન-૩ (A) આર્થિક મૂલ્ય વૃદ્ધિનો ખ્યાલ સમજાવો. (૦૮)
 (B) બજાર મૂલ્ય વૃદ્ધિનો ખ્યાલ સમજાવો. (૦૭)
 પ્રશ્ન-૪ નાણાંકીય અહેવાલ પ્રેષણ માહિતિનું ગુણવત્તાયુક્ત લાક્ષણિકતાઓ સમજાવો. (૧૫)

અથવા

- પ્રશ્ન-૪ કંપનીલક્ષી નાણાંકીય અહેવાલ પ્રેષણનો અર્થ અને ફાયદા સમજાવો.

ENGLISH VERSION

- Que-1 The balance sheets of Rajesh Ltd. are given as under. Interpret financial Economical position with the help of the technique of common size financial statements. (20)

Liabilities	31-3-23 (Rs.)	31-3-24 (Rs.)	Assets	31-3-23 (Rs.)	31-3-24 (Rs.)
Equity share capital	1,00,000	2,00,000	Fixed Assets	80,000	2,00,000
Preference share capital	20,000	40,000	Investments	60,000	20,000
General Reserve	20,000	50,000	Debtors	40,000	80,000
Profit and Loss Account	40,000	60,000	Closing Stock	20,000	80,000
Creditors	20,000	40,000	Cash	10,000	20,000
Outstanding Expenses	10,000	10,000			
	2,10,000	4,00,000		2,10,000	4,00,000

OR

- Que-1 From the following particulars. Prepare balance sheet of Mahesh Ltd. as on 31-03-2024.

Current Ratio	2.5
Liquid Ratio	1.5
Net working Capital	Rs. 3,00,000
Stock Turnover(Cost of sales/closing stock)	6 Times
Gross profit Ratio	20%
Fixed Assets Turnover Ratio(Cost of goods sold)	2 Times
Average Collection period(Debtors Ratio)	2 Months
Fixed Assets to share holder's funds	0.80
Reserve and surplus to share capital	0.50
Long term Loan to share holder's funds	0.20

- Que-2 Following is the balance sheet of Jay company as on 31-03-2023. (20)

Liabilities	Rs.	Assets	Rs.
Equity share capital	10,00,000	Fix Assets	12,00,000
Reserves	4,00,000	Stocks	2,00,000
Mortgage Loan	4,00,000	Debtors	4,00,000
Creditors	2,00,000	Cash-bank	2,00,000
	20,00,000		20,00,000

During year 2023-24 total purchase, sale and administrative expenses are Rs. 10,00,000, Rs. 16,00,000 and Rs. 2,00,000 each Respectively.

Calculate 10% Depreciation on fix assets, Rs. 3,20,000 is stock, Rs. 5,00,000 is debtors, Rs. 2,40,000 is creditors and Rs. 5,40,000 is cash on hand as on Dt. 31-03-2024. Normal Price base index is as Follows:-

Dt. 31-03-2023:	400
Dt. 31-03-2024:	600
Average of year 2023-24:	480

Use above Information and prepare final accounts as per historical cost method and current purchasing power method(CPP).

OR

Que-2 From the data given below calculate the gearing adjustment required under current cost Accounting(CCA) method.

Particular	01-04-2023 (Rs.)	31-03-2024 (Rs.)
Convertible Debentures	20,00,000	24,00,000
Bank overdraft	12,00,000	16,00,000
Cash	2,00,000	6,00,000
Paid up share capital	30,00,000	40,00,000
Reserves	10,00,000	16,00,000

(1) Cost of sales Adjustment(COSA) Rs. 4,00,000

(2) Monetary working capital Adjustment Rs. 3,00,000

(3) Depreciation Rs. 1,00,000

Total Rs.8,00,000

Que-3 Prepare a value-added statement from the following income Expenditure statement of the Jyoti Co. Ltd. (15)

Income-Expenditure statement for the year ended on 31-03-2024

Particulars	Rs.	Rs.
Sales	20,00,000	
Less: Cost of Material	<u>9,00,000</u>	11,00,000
Less: (1) Wages	4,00,000	
(2) Depreciation	1,00,000	
(3) Interest	<u>2,00,000</u>	<u>7,00,000</u>
		4,00,000
Less: Taxation		<u>2,00,000</u>
Profit after Tax		2,00,000
Less: Dividend		<u>1,00,000</u>
Retained Earning		1,00,000

OR

Que-3 (A) Explain the concept of Economic Value Added. (08)

(B) Explain the concept of market value Added. (07)

Que-4 Explain qualitative characteristics of financial reporting information. (15)

OR

Que-4 Explain the meaning and advantages of corporate financial reporting.
